



સત્યાને જાણતો

પી.ડી.ટાકર, આઈ.એ.એસ.

નિયામક

નં. મકમ/સ્થાવર જગમ મિલકત/૨૦૧૭-૧૮/૧૬૩૫

અગત્યનું

પરિપત્ર

નિયામક, સમાજ સુરક્ષા ખાતું  
બ્લોકનં. ૧૬, ગ્રાઉન્ડફ્લોર,  
ડૉ. જીવરાજ મહેતા ભવન,  
ગાંધીનગર - ૩૮૨૦૧૦.  
ફોનનં : ૦૭૯ - ૨૩૨૪૬૩૦૮  
ફેક્સનં : ૦૭૯ - ૨૩૨૪૬૩૦૮  
ઈ-મેઇલ : dir-sd@gujarat.gov.in

તારીખ ૨૩/૦૩/૨૦૧૮

વિષય :- ગુજરાત રાજ્ય સેવા વર્તણુક નિયમો, ૧૯૭૧ના નિયમ ૧૬(૧)ની જોગવાછ અન્વયે સરકારી કર્મચારીએ પોતાની સ્થાવર મિલકત જાહેર કરવા બાબત.

સંદર્ભ :- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા. ૧૫/૦૩/૨૦૧૮ના પત્ર ક્રમાંક - પરચ/૧૦૨૦૧૮/૧૫૨૮૨૫/ચ

ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ પત્રમાં દર્શાવેલ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૪/૦૩/૨૦૧૮ના પરિપત્ર ક્રમાંક સીડીઆર/૧૦૮૯/૮૧૧-તપાસ એકમની નકલ અન્વયે જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. નકલ આ સાથે સામેલ છે. આ પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. પરિપત્ર મળ્યાની પહોંચ ઉલટ ટપાલે મોકલી આપવા જણાવવામાં આવે છે.

નિયામક

સમાજ સુરક્ષા ખાતું

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

બિડાણ :- સામાન્ય વહીવટ વિભાગનો તા- ૧૪/૦૩/૨૦૧૮ નો પરિપત્ર પ્રતિ.

- તમામ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓને જાણ તથા જરૂરી કાર્યવાહી સારૂ.
- તમામ સરકારી સંસ્થા/કચેરીઓને જરૂરી કાર્યવાહી સારૂ.

નકલ સચિવનાના - પ્રતિ, સેક્શન અધિકારી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરને તા. ૧૫/૦૩/૨૦૧૮ના પત્ર ક્રમાંક - પરચ/૧૦૨૦૧૮/૧૫૨૮૨૫/ચ અન્વયે થયેલ કાર્યવાહી ની જાણ સારૂ.

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, ૧૯૭૧ના  
નિયમ ૧૮(૧)ની જોગવાઈ અન્યથે સરકારી  
કર્મચારીએ પોતાની સ્થાપન મિલકત આઠેર કરવા  
બાબત.

ગુજરાત સરકાર  
સામાન્ય વહીવટ વિભાગ  
પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૯-૬૧૧-તપાસ એકમ,  
સાચિવાલય, ગાંધીનગર,  
તારીખ:- ૧૪-૦૩-૨૦૧૮.

- વંચાણે લીધા : (૧) સા.વ.વિ.નો તા.૨૩-૦૭-૧૯૮૯નો પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૯-૬૧૧-તપાસ એકમ  
(૨) સા.વ.વિ.નો તા.૧૦-૦૯-૧૯૮૮નો પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૭-૧૪૭૦-ખા.ત.એ.  
(૩) સા.વ.વિ.નો તા.૧૩-૧૦-૧૯૮૮નો પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૮-યુઓ-૩૩૩-ખા.ત.એ.  
(૪) સા.વ.વિ.નો તા.૩૦-૦૩-૧૯૮૯નો પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૮-યુઓ-૩૩૩-ખા.ત.એ.  
(૫) સા.વ.વિ.નો તા.૦૯-૧૧-૧૯૮૯નો પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૮-યુઓ-૩૩૩-ખા.ત.એ.  
(૬) સા.વ.વિ.નો તા.૦૫-૧૦-૧૯૯૮નો પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૯૮-૧૦૬૩-ત.એ.  
(૭) સા.વ.વિ.નો તા.૧૪-૧૧-૧૯૯૮નો પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૯૮-યુઓ-૩૩૩-ખા.ત.એ.  
(૮) સા.વ.વિ.નો તા.૦૨-૦૯-૨૦૦૪નો પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૭-૧૪૭૦-ત.એ.

#### આમુખ:

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, ૧૯૭૧ના નિયમ ૧૮ (૧)માં કરવામાં આવેલ જોગવાઈ  
અન્યથે સરકારી અધિકારીઓને સ્થાપન મિલકતનું પત્રક કર્યાએ રજૂ કરવું તે અંગે નીચે મુજબની સૂચનાઓ  
પરિપત્રિત કરવામાં આવી છે.

(૧) સરકારી આધિકારીએ રજૂ કરવાના સ્થાપન મિલકતના પત્રક અંગેનો નમૂનો ઉપર વંચાણે લીધેલ કમાંક (૧)  
પરના પરિપત્રથી નિયત કરવામાં આવેલ છે.

(૨) ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમોના નિયમ ૧૮ના પેટા નિયમ (૨)અને (૩)ની જોગવાઈ મુજબ સરકારી  
અધિકારી સરકાર હેઠળની તેની પ્રથમ નિમણૂક વખતે નિયત નમૂનામાં પ્રથમ પત્રક રજૂ કર્યા પછી, વર્ષ દરમિયાન  
સ્થાપન કે જંગમ એવી નવી કોઈ મિલકતની ખરીદી કરે અથવા તેવી મિલકત પ્રાપ્ત થાય તો તે અંગેના વ્યવહારો કરતા  
ખમય પૂર્વ જાણા/પૂર્વમંજૂરીના કેસોમાં ઉપર વંચાણે લીધેલ કમાંક (૨) આગળના પરિપત્રથી નિયત કરેલ  
નમૂનામાં માહિતી તેમણે નિયત સચાધિકારીને રજૂ કરવાની રહે છે.

(૩) વગ-૧ના અધિકારીઓની સ્થાપન મિલકતના પત્રકો જે તે કેટોનું વર્ષ પૂર્ણ થયા પછીના જાન્યુઆરી માસમાં  
અને મોકામાં મોકા ૩૧મી માર્ચ સુધીમાં રજૂ કરવામાં નહીં આવે તો આ બાબતે ગેરવિસ્ત ગણીને આવા પત્રકો  
સમયસર રજૂ નહીં કરનાર અધિકારીઓનો એપ્રિલ માસનો પગાર અટકાવવાની સૂચનાઓ ઉપર વંચાણે લીધેલ  
કમાંક (૩)અને (૪) પરના પરિપત્રથી આપવામાં આવેલ છે.

(૪) સ્થાપન મિલકતના પત્રકો રજૂ કરવા અંગેની ઉપર વંચાણે લીધેલ કમાંક (૩) આગળના પરિપત્રની સૂચનાઓ  
વર્ગ-૨ના અધિકારીઓના ડિરસાઓમાં પણ લાગુ પાડવા અંગેની સૂચનાઓ ઉપર વંચાણે લીધેલ કમાંક (૫)  
પરના પરિપત્રથી આપવામાં આવેલ છે.

(૫) જંગમ મિલકતના વ્યવહારોની નિયત નમૂનામાં પાર્શ્વક જાહેરાત કરવા અંગેની સૂચનાઓ ઉપર વંચાણે લીધેલ  
કમાંક: (૫) આગળના પરિપત્રથી આપવામાં આવેલ છે.

(૬) સરકારી અધિકારીઓ દ્વારા સ્થાપન/જંગમ મિલકતના પાર્શ્વક પત્રકો તેમજ મિલકતના વ્યવહારો અંગે  
પૂર્વમંજૂરી કે પૂર્વજાણા સમયસર થાય અને તે દરેક અધિકારીની મિલકત તેની આપકના સાધનોના પ્રમાણસર હે કે  
કેમ તે અંગે વંચાણે લીધેલ કમ-(૭) અને (૮) પરના પરિપત્રથી સૂચના આપવામાં આવેલ છે.

૨. સરકારની ઉપરોક્ત સૂચનાઓ પ્રવર્તમાન હોવા છતાં, સરકારી અધિકારીઓ દ્વારા સ્થાપન મિલકતના પત્રકો  
સમયસર રજૂ કરવામાં આપતા નથી અથવા તો રજૂ કરવાનું ટાળવવામાં આવે છે, પરિણામે પત્રકો મેળવવાનો મૂળ હેતુ

સફળ થતો નથી અને કોઈ અધિકારી સાગે કોઈ ફરિયાદ-અરજુ ગળે ત્યારે જ આવા પત્રકો રજૂ થયેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ઘરથામાં આવે છે. જેમની સામે તપાસ કે ફરિયાદ ન હોય તેવા અધિકારીઓ દ્વારા પત્રકો રજૂ થયાં ન હોય તો તે મેળવયામાં પણ આપતાં નથી. આ પરિસ્થિતિ સંતોષકારક નથી.


સંદર્ભ (૧) થી (૮)માં પંચાંશી લીધેલ પરિપત્રની સૂચનાઓ હાલ અમલમાં છે. આ ઉપરાંત સરકારી અધિકારી દ્વારા તેમના મિલકત પત્રકો સમયસર રજૂ થાય તે માટે અગ્ર સચિવશ્રી(ક.ગ.), સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા:૩૧/૧/૧૮ અને તા: ૨૮/૨/૧૮ના પત્રોથી તમામ વિભાગોને સૂચનાઓ પણ આપવામાં આવી છે. તહુપરાંત સચિવશ્રીઓની બેઠકમાં પણ તા: ૩૧/૧/૧૮, તા:૭/૨/૧૮ અને તા:૨૮/૨/૧૮ના રોજ વિગતવાર ચર્ચા વિચારણા થયેલ છે આમ, મિલકત પત્રકો સમયસર રજૂ થાય તે માટે પૂરતા પ્રયત્નો કર્યા બાદ પણ અનુભવે એવું જણાયેલ છે કે, મિલકત પત્રકો સમયસર રજૂ થતાં નથી. આ સંજોગમાં સા.વ.વિ.ના તા: ૬/૧૧/૮૮ના પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૮-યુઓ-૩૩૩-ખા.ત.એ.ની સૂચનાઓનો ચૂસ્તપણે અમલ કરવો અનિવાર્ય જણાય છે. આથી, ઉક્ત પરિપત્રની સૂચનાઓના અનુસંધાને નીચે મુજબની અમલવારી કરવા તમામ વિભાગોને ભારપૂરક જણાપવામાં આવે છે.

(૧) સા.વ.વિ.ના તા:૧૩/૧૦/૮૮ અને તા: ૬/૧૧/૮૮ના પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૮-યુઓ-૩૩૩-ખા.ત.એ.ની સૂચના મુજબ સરકારી અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં તેઓનું મિલકત પત્રક સક્ષમ અધિકારીને રજૂ કરવામાં નહીં આવે તો આવા પત્રકો રજૂ નહીં કરનાર અધિકારીનો એપ્રિલ માસનો પગાર અટકાવવાનો રહેશે.

(૨) સા.વ.વિ.ના તા:૧૩/૧૦/૮૮ અને તા: ૬/૧૧/૮૮ના પરિપત્ર કમાંક: સીડીઆર-૧૦૮૮-યુઓ-૩૩૩-ખા.ત.એ.ની સૂચનાઓ મુજબ જો કોઈ કિરસામાં ૩૧ મી માર્ય સુધી તેમજ ત્યારપણી પણ આવા પત્રકો રજૂ નહીં કરવામાં આવે તો, આવા પત્રકો જ્યા સુધી રજૂ ન થાય, તે મહિના સુધીનો પગાર અટકાવવાનો રહેશે.

૩. ઉપર દર્શાવેલ સૂચનાઓ પોતાના નિયંત્રણ હેઠળના સર્વે પર્સ-૧ અને પર્સ-૨ના અધિકારીઓના દયાન ઉપર લાવવા અને ઉક્ત સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવા સર્વે વિભાગોને નિર્દેશ કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે

  
(મહુલ કે. વલસારો)  
ઉપ સચિવ (તપાસ.૨),  
સામાન્ય વહીવટ વિભાગ.

પ્રતી,

- \* માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજ્યવન, ગાંધીનગર.
- માન. મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
- સર્વે માન. કેલિનેટ મંત્રીશ્રીઓ/રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ, સચિવાલય, ગાંધીનગર.
- મુખ્ય સચિવશ્રીના નાયબ સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
- \* સચિવશ્રી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર.
- \* સચિવશ્રી, ગુજરાત તક્કેદારી આયોગ, ગાંધીનગર.
- \* રજિસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ.
- \* સચિવશ્રી, ગુજરાત આહેર સેવા આયોગ, અમદાવાદ.
- \* સચિવશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટીબ્યુનલ, ગાંધીનગર.
- \* સચિવશ્રી, ગુજરાત ગોણા સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
- \* સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, અમદાવાદ.
- \* સચિવશ્રી, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર.
- સચિવાલયના સર્વે વિભાગો.
- સર્વે ખાતાના વડાઓ/કચેરીના વડાઓ.
- સામાન્ય વહીવટ વિભાગના સર્વે અધિકારીઓ/શામાઓ
- ✓ સી.આઈ.ઓ., સા.વ.વિ., સચિવાલય, ગાંધીનગર પરિપત્રની નકલ વેલસાઈટ પર ઉપલબ્ધ કરવાની વિનંતી અનુભૂતિ અનુભૂતિ.
- \* સીલેક્ટ ફાઇલ.
- \* પત્ર દ્વારા.